

ત્વરિત જાહેરાત માટે

## સીટી ઓફ બ્રેમ્પટનની દસ સગવડોને કોમ્પિલમેન્ટરી (મફત) રિક હેન્સેન ફાઉન્ડેશન એક્સેસિબિલિટી સર્ટિફિકેશન રેટિંગ્સ મળશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 1, 2020) – સીટી ઓફ બ્રેમ્પટનના દસ સ્થળોને Rick Hansen Foundation Accessibility Certification™ (RHFAC - રિક હેન્સેન ફાઉન્ડેશન એક્સેસિબિલિટી સર્ટિફિકેશન) પ્રોગ્રામ મારફતે બિલ્ડિંગ એક્સેસિબિલિટીનો સ્નેપશોટ મેળવવા પસંદ કરવામાં આવ્યા છે. આ કોમ્પિલમેન્ટરી RHFAC રેટિંગ્સ મેળવીને, સીટી પસંદ કરેલી ઇમારતોના સુલભ (પ્રવેશયોગ્ય) સ્તરોની સમજણ અને ભાવિ પ્રવેશ સુલભ સુધારાઓ ઓળખી કાઢશે.

દસ પસંદ કરેલી સગવડોમાં સામેલ છે:

- લેસ્ટર બી. પિયરસન થિયેટર
- ધી રોઝ થિયેટર
- POA કોર્ટહાઉસ
- ગોર મેડોસ કમ્યુનિટી સેન્ટર એન્ડ લાઈબ્રેરી
- કાસી કેમ્પબેલ કમ્યુનિટી સેન્ટર
- સીટી હોલ (City Hall)
- BFES એપરેટસ એન્ડ મેઈન્ટેનન્સ ફેસિલિટી
- બ્રેમ્પટન ગેટવે ટર્મિનલ
- બ્રેમલી ટ્રાન્ઝિટ ટર્મિનલ
- સિંગ્રાઉલ લાઈબ્રેરી

રિક હેન્સન ફાઉન્ડેશન પોતાને મળતા ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોના ભંડોળને આભારી થતા, સમગ્ર ઓન્ટેરિયોમાં પસંદ કરેલી મ્યુનિસિપાલિટીસમાં 250 કોમ્પિલમેન્ટરી રેટિંગ્સ આપવાનું આયોજન કરશે. ધંધાઓ અને સાર્વજનિક ઇમારતો માટે RHFAC કાર્યપદ્ધતિનો ઉપયોગ કરીને RHFAC કાર્યક્રમ ઓળખી કાઢેલા અવરોધો કાઢી નાખવાની રીતો નિર્ધારિત કરવા મિલકત મેનેજરો અને માલિકોને મદદરૂપ થવા એક્સેસિબિલિટી (સુલભતા) રેટિંગ્સ પૂરા પાડવા તાલીમબદ્ધ વ્યવસાયિકોનો ઉપયોગ કરે છે, જેનો હેતુ છેવટે તેઓની જગ્યાઓ અને સમુદાયોને વધારે પ્રવેશ સુલભ બનાવવાનો છે.

કોમ્પિલમેન્ટરી RHFAC રેટિંગ્સ માટેની અરજીઓ કાર્યક્રમના બીજા રાઉન્ડ માટે હાલમાં નવેમ્બર 30, 2020 સુધી સ્વીકારવામાં આવી રહી છે. વધુ માહિતી અહીંથી મેળવો અને અરજી કરો, [www.rickhansen.com/ontarioratings](http://www.rickhansen.com/ontarioratings).

### ઝડપી હકીકતો

- RHFAC રેટિંગ્સ આ વર્ષના અંતે શરૂ થવા નિર્ધારિત કરવામાં આવ્યા છે જેનું સમાપન વર્ષ 2021 ની પાનખર ઋતુ સુધીમાં થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
- RHFAC કાર્યક્રમ મારફતે રેટિંગ મેળવતી સંસ્થાઓ પોતાના સ્થળ માટે ગોપનીય સ્કોરકાર્ડ રેટિંગ અને સફળતા અને સુધારાના મહત્વના ક્ષેત્રોનો અહેવાલ મેળવશે.
- આ કાર્યક્રમના બે પ્રમાણીકરણ સ્તરો છે: RHF એક્સેસિબિલિટી સર્ટિફાઈડ અને RHF એક્સેસિબિલિટી સર્ટિફાઈડ ગોલ્ડ.

- સીટી ઓફ બ્રમ્પટન અને તેની [એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી](#) તમામ ઉંમરના અને ક્ષમતાઓ ધરાવતા લોકો પોતે બ્રમ્પટનમાં રહે, કામ કરે, રમતો રમે, મુલાકાત લે અને રોકાણ કરે ત્યારે તેઓને સરખી તકો મળી રહે તેની ખાતરી કરાવવા કટિબદ્ધ છે.

**અવતરણો (ક્વોટ્સ):**

“સીટી ઓફ બ્રમ્પટન એક મોઝેઈક છે, અને અમે અશક્તતા ધરાવતા લોકો માટે અવરોધો હટાવવા કટિબદ્ધ છીએ જેથી કરીને આપણાં સમગ્ર વૈવિધ્યસભર સમુદાયમાં દરેક વ્યક્તિ સંપૂર્ણપણે સહભાગી બની શકે છે. હું સીટીની દસ સગવડોને RHFAC રેટિંગ્સ મળવાની તકને આવકારું છું, અને હું રિકને ઓટ્ટાવામાં મળ્યો અને તેમણે સીટીને અરજી કરવાનું પ્રોત્સાહન આપ્યું ત્યારે પહેલી વખત ફાઉન્ડેશનના પ્રમાણીકરણ વિશે સાંભળ્યું હોવાનું અજ્ઞાન મને યાદ છે. આપણાં સ્થળોના સુલભતાના સ્તરોની વધારે સારી સમજમાં, આપણે બધાં લોકો માટે વધારે સર્વગ્રાહી અને સુલભ (પ્રવેશયોગ્ય) શહેર બનાવવા તરફ કામ કરવાનું ચાલુ રાખી શકીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી પર કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે, હું એ સાંભળીને રાજી થઉં છું કે આપણાં શહેરના દસ સ્થળોને કોમ્પ્લિમેન્ટરી RHFAC રેટિંગ્સ મળશે. અવરોધો હટાવવાથી આપણું શહેર દરેક વ્યક્તિ માટે સુલભ (પ્રવેશયોગ્ય) બને છે, અને આપણી ઈમારતોના સુલભ સ્તરોની સમજમાં, આપણે પ્રોવિન્સિયલ AODA નિયમનોને અનુરૂપ અને તેને વટાવી જતા માહિતગાર સુલભ સુધારાઓ કરી શકીશું, જેનાથી બધાં રહેવાસીઓ શહેરની સગવડોનો આનંદ માણી શકશે.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8, એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી કાઉન્સિલ સભ્ય, સીટી ઓફ બ્રમ્પટન; સભ્ય, રીજયન ઓફ પીલ એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી

“સીટી ઓફ બ્રમ્પટનને, અમે તે બધી ક્ષમતાઓ ધરાવતા લોકોને સેવા આપી શકે તેવું મોઝેઈક શહેર બનાવવા કટિબદ્ધ છીએ. આપણાં દસ પસંદ કરેલા સ્થળો માટે RHFAC રેટિંગ્સ મેળવીને, આપણે આપણી સગવડોને બધાં બ્રમ્પટનવાસીઓ માટે વધારે સુલભ (પ્રવેશયોગ્ય) બનાવવા પર વધારે સૂઝ મેળવીશું, અને ભાવિ સુલભતા સુધારાઓ તે પ્રમાણે કરવાની સ્થિતિમાં હોઈશું.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)